

ગુજરાત જાહેર સેવા આયોગ

રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા ઉમેદવારોની યાદી

:: સુધારા યાદી ::

વંચાણે લીધી:(1) આયોગની તા.23.02.2017ની અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી.

(2) આયોગની તા.13.04.2017ની રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદી

1. સરકારી ઇજનેરી કોલેજ ખાતે મેટલર્જીના સહાયક પ્રાધ્યાપક, વર્ગ-2ની જગ્યાએ ભરતી કરવા માટે જાહેરાત ક્રમાંક: 87/2015-16ના સંદર્ભમાં આયોગ દ્વારા તા.21.08.2016ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીના આધારે અરજી ચકાસણીને પાત્ર થતા કુલ: 20 ઉમેદવારોના બેઠક નંબરોની યાદી આયોગની કચેરી દ્વારા તા.23.02.2017ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ત્યારબાદ અરજી ચકાસણીને અંતે રૂબરૂ મુલાકાતને પાત્ર થતા કુલ: 16 ઉમેદવારોની યાદી તા.13.04.2017ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.

2. આ જગ્યાની જાહેરાત તા.24.11.2015ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, તથા તેમાં ઓન-લાઇન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ:09.12.2015 નિયત થયેલ છે. આ જગ્યાની જાહેરાતની શૈક્ષણિક લાયકાતની જોગવાઈ અનુસાર, ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની એન્જીનીયરીંગ અથવા ટેકનોલોજીની સંબંધિત વિષયમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવી જે પૈકી સ્નાતક અથવા અનુસ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગની પદવી કે તેની સમકક્ષ લાયકાત અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.

3. આયોગની કચેરી દ્વારા તા.13.04.2017ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીમાં બેઠક નંબર.101000080 પરના ઉમેદવારએ નોર્થ ટેકસાસ યુનિ.ની Ph.D.ની પદવી ધરાવતા હોવાનું પ્રમાણપત્ર રજુ કરેલ પરંતુ અનુસ્નાતકની પદવીની સમકક્ષતા બાબતે કોઈ આધાર પુરાવા રજુ કરેલ ન હોઈ, રૂબરૂ મુલાકાત માટે અપાત્ર ગણવામાં આવેલ હતા.

4. આયોગ દ્વારા તા.04.05.2017ના રોજ લેવાયેલ નિર્ણય મુજબ શ્રી મૃણાલકુમાર દિલીપભાઈ ચૌધરીએ મેળવેલ નોર્થ ટેકસાસ યુનિ.ની Ph.D.ની પદવીમાં જ અનુસ્નાતક પદવીનો સમાવેશ થતો હોઈ, રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવાના થાય છે.

5. આથી હવે બિન અનામત (પુરૂષ) વર્ગના ઉમેદવારોની રૂબરૂ મુલાકાત માટેની પાત્રતા આયોગના તા.14.10.1986ના કચેરી હુકમથી નક્કી થયેલ માપદંડ અનુસાર નક્કી કરવાની થાય, આ જાહેરાત માં જણાવેલ બિન અનામત (પુરૂષ) વર્ગ ની કુલ: 02 જગ્યાઓ સામે નોર્મ્સ મુજબ કુલ: 08 (આઠ)

2

ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે પાત્ર જાહેર કરવાના થાય છે. શ્રી ચૌધરી (બેઠક નંબર. 101000080)ને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણતાં બિન અનામત (પુરૂષ) વર્ગના ઉમેદવારો ની કુલ: 02 જગ્યાઓ સામે સરખા ગુણને કારણે હવે કુલ: 09 (નવ) ઉમેદવારો રૂબરૂ મુલાકાત માટે પાત્ર થાય છે. આમ બિન અનામત (પુરૂષ) વર્ગના કોઈ ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે અપાત્ર ગણવાના રહેતા નથી.

6. આયોગની કચેરી દ્વારા તા.13.04.2017ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોના બેઠક નંબરની યાદીમાં બેઠક નંબર: 101000080 નો સમાવેશ કરવામાં આવે છે, અને આ યાદી હેઠળની નોંધ (1): “આયોગે નક્કી કરેલ લાયકી ધોરણ (Passing standard) ધરાવે છે, પરંતુ જાહેરાતની જોગવાઈઓ પરિપૂર્ણ કરતા ન હોઈ રૂબરૂ મુલાકાત માટે પાત્ર થતા નથી.” માંથી બેઠક નંબર: 101000080 રદ કરવામાં આવે છે. તા.13.04.2017ના રોજ પ્રસિધ્ધ થયેલ રૂબરૂ મુલાકાતને પાત્ર ઉમેદવારોની યાદીની અન્ય વિગતો યથાવત રહેશે.

સ્થળ: ગાંધીનગર-382010

તારીખ: 15.05.2017

Sd/-

(ટી. એચ. સોની)

સંયુક્ત સચિવ

ગુજરાત જાહેર સેવા આયોગ